



REDEX

PROTECH LIMITED

TOTAL FIRE PROTECTION COMPANY

CORPORATE OFFICE :

A-5, JAYMANGAL HOUSE,

OPP. GANDHIGRAM RLY. STATION,

AHMEDABAD- 380 009 (INDIA)

PHONE: - 26584080, TELEFAX : 079 -26587009

CIN - L31100GJ1991PLC016557

Date: 14/08/2018

To,
Gen. Manager (DCS)
BSE Limited.
P J Towers, Dalal Street,
Fort, Mumbai-400001

SUB: INTIMATION OF ADVERTISEMENT IN NEWSPAPER UNDER REGULATION 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS 2015.

REF: COMPANY CODE BSE: 523650 (REDEX PROTECH LIMITED)

Dear Sir,

Please find enclosed herewith copy of Advertisement given in newspaper of unaudited financial results for the quarter ended on 30th June, 2018 in compliance of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said financial results were reviewed by Audit committee and approved by the Board of Directors at its meeting held on 13th August, 2018.

You are requested to take the same on your record.

Thanking You.

Yours Sincerely,

FOR, REDEX PROTECH LIMITED

**MR. GNANESH BAHGAT
MANAGING DIRECTOR
(DIN: 00115076)**



CHANNAKYA

NIPOTH

KKR acquires 60% stake in Ramky Enviro for \$530 m

Investment firm KKR has acquired a 60 per cent stake in Ramky Enviro Engineers Ltd for approximately \$530 million via a combination of primary and secondary offerings.

The investment, which was made from its Asian Growth Fund, values the company at \$850 million.

BusinessLine had earlier reported about the likely acquisition.

KKR's investment in REEL is one of the largest in India, in addition to being the first private equity investment in the country's highly regulated environmental sector.

Goutham Reddy, Managing Director and CEO of KKR, said: "With KKR as our partner, we look forward to achieving our mission of responsibly addressing the environmental issues that are affecting economies including India today."

Today marks the beginning of the next stage of REEL's evolution towards a sustainable society."

Praveen Nayar, Member & Managing Director at KKR India, said: "We are excited to partner with REEL's work uniquely in the Swachh Bharat



of a company that provides critical services and infrastructure to reduce pollution and address the needs of India's expanding urban population."

"We look forward to leveraging our resources to enhance REEL's operational best practices and add value by focussing on engineering innovation, attracting managerial talent and boosting efficiency, in addition to building on REEL'S rigorous focus on environmental, health and safety initiatives," said Rupen Jhaveri, Managing Director at KKR.

Legal, tax advisors

Barclays and EY are acting as REEL and KKR's advisors, respectively.

Link Legal is serving as REEL's legal counsel, and PwC and Transaction Square as its tax advisors.

Cyril Amarchand

as KKR's legal counsel, with Deloitte India acting as accounting and tax advisor.

Environmental Resources Management is the environmental management advisor to the deal.

Range of services

Hyderabad-based REEL, part of the Ramky Group, is an environmental engineering services company. Its offerings include management, collection, transport and processing of hazardous, municipal, biomedical and e-waste, as well as the recycling of paper, plastic and chemicals.

The company is into renewable energy, with a focus on waste-to-energy processes, and offers consulting and integrated environmental services.

Global presence

REEL has a presence in over 60 locations across 20 States, as well as in certain South-East

Hindalco to prepay Rs. 3,000-crore debt this fiscal

Hindalco Industries, an Aditya Birla Group company, plans to prepay Rs. 3,000-crore debt this fiscal to bring down its debt-equity ratio to about two times from the current level of three times.

The company has managed to save Rs. 139 crore in finance cost in the June quarter as it pre-paid Rs. 1,500 crore in the same quarter. The company's net debt come down to Rs. 17,297 crore in the June quarter against Rs. 27,800 crore in the same period last year.

Satish Pai, Managing Director, Hindalco Industries, told BusinessLine that each of the business has been throwing cash, with demand for both aluminium and copper picking up with the uptrend in economy.

The idea behind debt prepayment is to restrict the consolidated net debt to equity at about three times even after the US subsidiary Novelis raises about \$2.6 billion (about Rs. 17,800 crore) early next year to fund acquisition of the global

fund the Aleris deal and finance it to a lower rate," said Pai.

Curbs on imports

Hindalco is expecting government to levy quantitative restrictions on aluminium imports this quarter as the industry is gearing up to file trade data sought by the Government. Aluminium imports in the form of scrap have gone up by 20 per cent last quarter raising industry concern. "Despite strong demand, we had to export 10 per cent of production due to sharp rise in imports. Once restrictions are imposed, the company plans to sell 70 per cent in domestic market where the realisations are much more. High shipping and other logistics eat into export realisation," he said.

The government has already clamp down on cheap imports soon as the demand in domestic market is growing much faster than expected and the benefits will be taken away by foreign companies.

Though the current global trade war is a concern in the long run, Pai said it has

impacted India's exports so far. The company does not export much to the US while the levy of 7.5 per cent duty in Europe and some of the Asian countries is manageable, he said.

y 24 trading o tech glitch'



After a halt, when NOW was re-started at around 2:45 pm, we tried squaring up some of our positions but the software automatically executed more trades. At 3:30 pm (end of trading day) there were still more orders pending."

Most large brokers have their own trading forms to connect to the NSE; it is the small ones catering to retail clients who use NOW.

'No impact on NSE system'

An NSE spokesperson said in a response to BusinessLine's email query: "The incident on May 24, 2018, is pertaining to the NOW application and not the Trading System & Clearing Systems of NSE." "The NOW application is disparate from the trading system and it has no direct impact on the functioning of NSE's trading system and connects like all other front-end applications from the broking entities."

"During the disruption, the members were able to connect to the exchange through the other front end applications. NSE Data had reported the incident in the NOW application to SEBI... We are unaware of the SEBI TAC related report submitted in the matter.

announced that it is acquiring Chennai-based SPI Cinemas in a cash-cum-stock deal valued at around Rs. 845 crore.

Under the terms of the proposed deal, PVR will acquire a 71.7 per cent stake in SPI Cinemas, a significant player in South India, for Rs. 633 crore and issue 1.6 million equity shares of PVR constituting 3.3 per cent of the diluted paid-up equity share capital of the company valued at around Rs. 212 crore.

With a network of 76 screens (68 operational and eight expected to open shortly) across 17 properties in 10 cities, SPI expects to roll out 100 more screens over the next five years. Among its key properties is Chennai's Sathyam complex.

Post-acquisition, PVR's total screen count will increase to 706 across 152 properties in 60 cities, making it the seventh

Post the deal, PVR will have 235 screens in the South.

A PVR press release said both Kiran Reddy and Swaroop Reddy of SPI Cinemas will continue to remain associated with the business and provide strategic guidance in integrating it with PVR to create value for all the stakeholders.

"The acquisition will make PVR the undisputed leader in the South Indian market and provide an attractive platform for us to expand in that geography, which currently is highly under-penetrated in terms of multiplexes," said Ajay Bijli, CMD of PVR.

"We are excited to partner with the largest Indian multiplex chain PVR, as this combines two proven business models and will create significant value for moviegoers as well as all the stakeholders," said Kiran Reddy, CEO, SPI Cinemas.

scrapping of old vehicles will lead to availability of metals to be recycled. This will cut the cost of production which, in turn, will lead to lower retail price. "Apart from this, we are also working on how to lessen the interest burden for the transporters. The Government will earn more, so a part of that can be used to help the transporters get loan at cheaper rate," the official said.

The proposed policy will need the nod of the Union Cabinet and the GST Council. The Road Ministry's proposal to the GST Council also comprises two components: First, either exempt the transaction related to the scrapping or levy 5 per cent GST under the Reverse Charge Mechanism; and second to prescribe GST rate of 18 per cent from the present 28 per cent for the replacement vehicle.



REDEX PROTECH LIMITED

CIN - L31100GJ1991PLC016557

Corporate Office : A-5, Jaymangal House, Opp. Gandhigram Rly. Station, Ahmedabad - 380 009 PH: 079-26584080, 26587009

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.06.2018

Sr. No	PARTICULARS	Quarter ended on 30th June, 2018	For the year ended on 31st March, 2018	Corresponding 3 Months Ended on 30th June, 2017
1	Total income from operations	8.23	32.33	7.83
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-0.57	15.03	1.56
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	-0.57	15.03	1.56
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	-0.52	12.48	1.37
5	Total Comprehensive income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive income (after tax)]	-0.52	12.48	1.37
6	Equity Share Capital	672.12	672.12	672.12
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of Previous Year		-184.1	
8	Earnings Per Share (of Rs. / - each) (for continuing and discontinued operations)			
	Basic :	-0.01	0.19	0.02
	Diluted :	0.00	0.00	0.00

Notes:

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website www.redexprotech.com.
- The result of the Quarter ended on 30th June, 2018 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 13th August, 2018.

BY ORDER OF THE BOARD OF DIRECTORS,
FOR, REDEX PROTECH LTD
SD/-

(GNANESH BHAGAT)
(DESIGNATION - DIRECTOR)
(DIN - 00115073)

Place : AHMEDABAD
Date : 13.08.2018

ધી

જ્યુઝલાઈઝ

વર્ષ : ૨૪ અંક : ૨૯૭ તા. ૧૪-૦૮-૨૦૧૮ પાનાં ૪ માલિક : જયની પબ્લીશર્સ તંત્રી : રણછોડ એન. શાહ સહ તંત્રી : રાધિકા

બેન્ક શેરોમાં હવે ફેન્સી વધી રહી છે

ગયા અઠવાડિયા દરમિયાન મિલનાડુ પેટ્રો મોડેલના શેરમાં મુખ્ય ઉછાળાની સંભાવના દર્શાવેલી છે. ૩૮૦ના ભાવે લેવાયેલો તે શેર અત્યારે મૂલ્યમાં ૪૩.૪૦ ટક વધી ગયો અને તે પછી અઠવાડિયા દરમિયાન આ શેરમાં ૩.૪૩.૨૫નો વધારો જોવાયા પછી શેર અત્યારે ૩.૧૦ના લેવલ ઉપર બંધ આવ્યો છે. તે રીતે લગભગ ૩.૫નો ઉછાળો જ અઠવાડિયામાં આ શેરે આપી

રોકાણકારોને સુંદર રિટર્ન આપ્યું છે. ચીનમાં ગ્રેકાઈટ ઈલેક્ટ્રોનું ઉત્પાદન બંધ થયું હોવાથી આ કંપનીની માંગ

આંકડાની અદલાબદલીની રાહ જોઈ રહ્યા છે અને ૩.૩૭૨ના ભાવની પૂરેપૂરી સંભાવના.

મહારાષ્ટ્ર સિમલેસના શેરમાં હવે આકર્ષણ વધ્યું

૩૬૫થી વધી ગઈ છે. અત્યારે ૩.૧૧૦૭ ઉપર આવી ગયો છે અને આગામી દિવસોમાં આ શેરમાં ૩.૧૧૯૯નો ભાવ આવવાની સંભાવના મજબૂત છે અને તે પછીના ઉછાળે ૩.૧૨૧૨ પણ બતાવે.

તેવી જ રીતે મુંબઈ ખાતે વિશાળ રિયલ એસ્ટેટ પરાવતી જેબી ટેમિટલ એન્ડ ફાર્માસ્યુટિકલ માટે સારો સમય છે. શેર અત્યારે ૩.૨૯૯ ઉપર છે અને તેમાં ૩૬૫ની ડરનારને ૩.૫૦ની નોટ મળી જવાની ગણતરી.

મહારાષ્ટ્ર સિમલેસના શેરમાં હવે આકર્ષણ વધ્યું છે. આ કંપની સિમલેસ પાઈપના ઉત્પાદનમાં ટોચનું નામ છે અને જિંદાલ સ્ટીલની કંપની છે. લગભગ બેઝેક વર્ષ આ શેર નબળી રહી હતી અને હવે સિમલેસ પાઈપની માંગ ૩૬૫થી વધી હોવાથી બોટમલાઈનમાં પણ ૩૬૫ની ઉછાળો છે. અત્યારે મહારાષ્ટ્ર સિમલેસનો શેર ૩.

ગયા અઠવાડિયા દરમિયાન એસઆરએફના શેરમાં પણ જોરઠાર ઉછાળો જોવા મળ્યો હતો. એસઆરએફના શેરે પણ છેલ્લા ૬ મહિનામાં રોકાણકારોને ભરપૂર કમાણી આપી છે. અત્યારે ૩.૧૯૦૪ ઉપર આવેલા આ શેરમાં ૩૬૫થી ૩.૧૦૦ની નોટ મળી જવાની ગણતરી. પરંતુ શેર હવે ટોપની નજીક આવતો ગયો હોવાથી સંભાળીને કામ કરવું જરૂરી છે.



અદાણી પાવરનો શેર પણ ૩.૫૫ના ભાવથી ક્વર કરવાનું દર્શાવતા ગયા અઠવાડિયા અદાણી પાવર ૩.૫૨ ઉપર હતો અને તે પછી ઝાડિયા દરમિયાન આ શેરમાં ૩.૬૦નું ટોચ બન્યા પછી અત્યારે પછી પાવરનો શેર ૩.૩૧ ઉપર બંધ થયો છે અને આ શેરમાં રોકાણની રાખજો. આગામી દિવસોમાં પીરે ભાવ વધીને ૩.૩૫-૩૬ આવી જવાની ગણતરી છે.



૪૯૧માં ક્વર કરી શકાય અને થોડાં દિવસોમાં જ આ શેરમાં ૩.૫૩૧નો ભાવ આવી જવાની સંભાવના મજબૂત છે

પેઈન્ટ શેરોમાં લાઈકેપમાં એશિયન પેઈન્ટ જ્યારે મિડકેપમાં બર્જર પેઈન્ટ અને કન્સાઈન નોરોલેકના શેરોનું આકર્ષણ વધ્યું છે. બર્જર અત્યારે ૩.૩૨૮ ઉપર છે અને આગામી દિવસોમાં શેરમાં ૩.૩૫૫

જ્યુબિલન્ટ ફૂડના શેરમાં પણ મજબૂત ઉછાળો છેલ્લાં વખતે અઠવાડિયાથી દર્શાવીએ છીએ. જ્યુબિલન્ટ ગયા અઠવાડિયા ૩.૧૪૫૨ ઉપર હતો અને પાંચ ટ્રેડિંગ સેશનમાં વધી ૩.૧૫૨૧ ઉપર આવ્યો છે. રોકાણ જાગવી શકાય અને આગામી દિવસોમાં આ શેરમાં ૩.૧૫૮૫નો ભાવ આવી જવાની સંભાવના મજબૂત છે.

આ વર્ષે નફો સુંદર આવશે સાથે ડિવિડન્ડ પણ જોરઠાર આગામી દિવસોમાં આ ૩૦૩ના ભાવની ગણતરી.

રિલાયન્સ પાવરનો કરવાનું દર્શાવ્યું હતું. અંબાણી મુંબઈ ખાતેનો મ અને નફાકારક ડિસ્ટ્રીબ્યુટ વેચી મારતા હોય તો અંબા પ્લાન્ટ ગમે ત્યારે વેચાઈ જ છે અને તે વખતે આ કંપન દેવામુક્ત થઈ જવાની અ અનિલ અંબાણી મુખ્ય દેવ લેટન હોય પરંતુ મ મહિનાઓમાં જ બોજી નીકળ



અને તે પણ પણ આ શેરમાં રૂ. ૫૫૫નો ભાવ જોવા મળે તો નવઠી નહીં લાવે

તેવી જ રીતે બાટા ઇન્ડિયાના

શેરમાં ગયા અંકમાં અને છેલ્લા થોડા અઠવાડિયાથી ઉછાળાની સંભાવના દર્શાવી છે. બાટા ઇન્ડિયા ગયા અઠવાડિયા રૂ. ૯૭૮ ઉપર હતો અને અત્યારે વધીને રૂ. ૯૭૯ ઉપર આવ્યો છે. પરંતુ ઉંચા વીકમાં આ શેરે રૂ. ૯૭૮નું ટોપ બતાવેલું. બાટામાં રોકાણ જાળવી શકાય અને આગામી દિવસોમાં બાટાના શેરમાં રૂ. ૧૦૩૪નો ભાવ આવી જવાની સંભાવના મજબૂત છે.

તેવી જ રીતે અદાણી એન્ટરપ્રાઇસિસનો

શેર પણ અત્યારે ખેલાડીઓના હાથ ઉપર ચડ્યો છે. અદાણી એન્ટરપ્રાઇસિસ રૂ. ૧૯૯ ઉપર છે અને આગામી દિવસોમાં આ શેરમાં રૂ. ૨૧૨ અને તે પછીના ઉછાળે રૂ. ૨૨૨નો ભાવ આવી જવાની સંભાવના મજબૂત છે.

ગ્રેકાઈટ ઇન્ડિયાનો

શેર ધ્યાનમાં રાખજો. એમ પણ છેલ્લા ૬ મહિના દરમિયાન એકાઉન્ટના શેર

સોલિડ પરિણામો બતાવતી

જિંદાલ પોલિક્લિલસ પેકેજિંગ મટિરિયલ્સના વંદામાં ખૂબ જ મોટું નામ છે અને અત્યારે લગભગ તમામ સારી એફએમસીજી પ્રોડક્ટોમાં જિંદાલ પોલિક્લિલસનું મટિરિયલ્સ જ વપરાય છે. સુંદર નફાશક્તિ હોવા છતાં શેર ઘણા મહિનાઓ સુધી ઠીક પડી રહ્યો હતો. અત્યારે રૂ. ૨૭૮ના ભાવે આ શેરને ધ્યાનમાં રાખજો અને આગામી દિવસોમાં આ શેરમાં ભાવ ઝડપથી વધીને રૂ. ૩૦૩ થઈ જવાની ગણતરી છે.

તેવી જ રીતે ઘણા

મહિનાઓથી ભુલાઈ ગયેલા શિપિંગ શેરીમાં આર્કર્ષક વધુ છે અને ખાસ કરીને રૂ. ૩૨૭નાથો **ગુઈ શિપિંગ**નો શેર ખેલાડીઓના ફોકસ ઉપર આવ્યો છે. બોનસ કે અવી કોઈ જરૂરતા આવે તો પણ નવાઈ નહીં લાગે. જઈ શિપિંગમાં ખેલાડીઓ

અને તે પછી આંકડાની પુરી અદલાબદલી સાથે રૂ. ૩૮૨નો ભાવ જોવા મળવાની ગણતરી. તેવી જ રીતે **એસઆઈએલ** અત્યારે રૂ. ૫૨૫ ઉપર છે અને તેમાં પણ આંકડાની અદલાબદલી સાથે રૂ. ૫૫૨નો ભાવ જોવા મળવાની ગણતરી છે અને તે પછીના ઉછાળે રૂ. ૫૬૬નો ભાવ જોવા મળે.

ઓટોમોબાઈલ બેટરી બનાવતી **એક્સાઈડના** શેરમાં કેન્સી વધી છે. એક તરફ કાર અને તમામ પ્રકારનાં વાહનોના વેચાણ વધ્યા છે એટલે સ્વાભાવિક છે કે બેટરીના વેચાણે પણ વધે. પરંતુ હવે આ કંપની ઈલેક્ટ્રિક વાહનો માટેની ઓછી બેટરીનું ઉત્પાદન પણ શરૂ કરશે એટલે તેની બેટરીની દુકાન બીજા થોડા વર્ષો પણ ચાલતી રહેશે તેવી ગણતરી છે અને દુકાન ચાલશે તે સમાચાર પાછળ એક્સાઈડના શેર પણ છેલ્લા થોડા દિવસોમાં રૂ. ૨૭૧ ઉપર આવી ગયો અને આગામી દિવસોમાં આ શેરમાં રૂ. ૩૧૧નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત છે.

૬૦૦ના ભાવ પસાર થઈ જવાની સંભાવના મજબૂત અને તે પછી થોફીટ બુકીંગ શરૂ કરી દેવું.

રૂ. ૬૨૧ના **વોલ્ડાના** શેરમાં કેન્સી વધતી જાય છે. ટાટા ગ્રુપની આ કંપનીમાં આ નવેવારોની સિઝનમાં ફોજ અને એકેન્ડા વેચાણો જોરદાર થવાની ગણતરી છે. રૂ. ૬૨૧થી વધીને રૂ. ૬૫૧ના ભાવની સંભાવના મજબૂત.

સાઈકોલોજીકલ એક અત્યારે રૂ. ૬૨ ઉપર જાયરવટી રહ્યો છે અને આગામી દિવસોમાં અઈસીઆઈ બેન્કના શેરમાં જોરદાર ઉછાળા સાથે રૂ.

આ ગ્રુપના નવાઈ નવ ધાવર અને **કોમ્યુનિકેશન** વર્કીંગ મૂકી છે એલએ ૨૫ ઉપર ભવ ભારત સરકાર એન્ટીપોસ્ટી સ વખતે રૂ. સંભાવના મજબૂત ગયા **ધાવર ફિલ્મ** ૮૭ ઉપર ભવ

સાંત ચિંત મટે મગજને દત્તેવ રાંધે અકાળમણ, ગુસ્સું ટૂટ કરે સે મંટે વેડો ઇંડુ કેંદવડ મેગેઝીન

મગજમારી

વિદ્યુત હોંડે, ગૃહિણીએ, ખાલકો કલેક્ટીવ પ્રવેશો ચૂકવલો મટે બેસ્ટ

જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ

REDEX PROTECH LIMITED

CIN - L31100GJ1991PLC016557
Corporate Office : A-5, Jaymangal House, Opp. Gandhigram Rly. Station, Ahmedabad - 380 009 PH: 079-26584080,26587009

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.06.2018

Sr. No	PARTICULARS	Quarter ended on 30th June, 2018	For the year ended on 31st March, 2018	Corresponding 3 Months Ended on 30th June, 2017
1	Total income from operations	8.23	32.33	7.85
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-0.57	15.03	1.56
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	-0.57	15.03	1.56
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	-0.52	12.48	1.37
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	-0.52	12.48	1.37
6	Equity Share Capital	672.12	672.72	672.12
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of Previous Year		-154.1	
8	Earnings Per Share (of Rs. / - each) (for continuing and discontinued operations)			
	Basic	-0.01	0.19	0.02
	Diluted :	0.00	0.00	0.00

Notes:
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website www.redexprotech.com.
2. The result of the Quarter ended on 30th June, 2018 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 13th August, 2018.

BY ORDER OF THE BOARD OF DIRECTORS,
FOR, REDEX PROTECH LTD
SD/-
(GNANESH BHAGAT)
(DESIGNATION - DIRECTOR)
(DIN - 00115076)

Place : AHMEDABAD
Date : 13.06.2018

દાંડનો ભાવ આવવાની ગણતરી છે અને તેમાં રોકાણ જાળવી શકાય જ્યારે **આઈએફસીઆઈ** અત્યારે રૂ. ૧૭ ઉપર છે અને તે શેરમાં પણ સેન્ટ્રલ મુદ્દા સાથે થોડાં અઠવાડિયામાં રૂ. ૨૦-૨૨નો ભાવ આવવાની ગણતરી છે.

રિલાયન્સ ડેવિલ અત્યારે રૂ. ૪૭૦ ઉપર ચાલે છે અને આ કંપની પેટા કંપની **રિલાયન્સ પબ્લિક ઇન્સ્યોરન્સ**ની આઈપીઓ અને ત્યારે જરૂર થઈ જવાની ગણતરી એમ તે પ્રોસ્પેક્ટસ ઘણાં સમય પહેલાં જાહેર થઈ ગયું છે. રિલાયન્સ ડેવિલના આગામી દિવસોમાં રૂ. ૪૯૫ના ભાવ બંસે છે.

એલએન્ડી

હોલિંગ ગયા અઠવાડિયે રૂ. ૧૮૦ના ભાવે પકડી લેવાનું કહ્યું હતું તેમ છતાં છેલ્લી ૨ ટ્રેડિંગ સેશન ઇન્ડિયન આવેલી વેચવાલીને કારણે શેર અત્યારે રૂ. ૧૭૭ ઉપર છે અને તેમાં રોકાણ જાળવી શકાય. આ વખતે જોરદાર કેન્સી સાથે થોડાં અઠવાડિયાઓમાં રૂ. ૧૯૦-૨૦૦નો ભાવ જોવા મળવાની ગણતરી.

હિંદુસ્તાન પ્રીક અત્યારે રૂ. ૨૮૭ ઉપર છે અને સ્લો ગ્રોથની જોરદાર માંગ હોવાને કારણે આના વેચાણમાં જોરદાર ઉછાળો અપેક્ષા છે.

રાખજો. ખરેખર પતી ગયો છે અને રૂ. ૯૭ ઉપર ભાવ અને તેવી જ રીતે અત્યારના રૂ. ૧ જાળવી શકાય મજબૂત ઉછાળાને



TIT be me
Stay